

કોવિડ-19 (Covid-19) કિસ્સાઓ ઉપર આધારિત પબ્લિક હેલ્થ ટીમ દ્વારા અઠવાડિક નિવેદન

12 ઓગસ્ટ 2021

6 ઓગસ્ટના રોજથી સાત દિવસો સુધીમાં (કે જેનો આધાર 11 ઓગસ્ટના પ્રસિધ્ધ થયેલ ડેટા- માહિતી ઉપર રાખવામાં આવે છે) બ્રાઈટન અને હોવમાં (Brighton & Hove) અમારે કોવિડ-19 ના (COVID-19) નવા 1375 કન્ફર્મ્ડ કે સમર્થિત કિસ્સાઓ થવા પામ્યા હતાં – કે જે અગાઉના અઠવાડિયાના 1135 ના આંકડા કરતા વધારે રહ્યા છે. આ છે:

- અગાઉના અઠવાડિયા કરતાં 21% ઉપર
- કે જે 100,000 રહેવાસીઓ દીઠના સમાનાર્થ કે તુલ્ય અઠવાડિક દર પ્રમાણે 471 કહેવાય – જે 100,000 દીઠ અગાઉના અઠવાડિયામાંથી 390.2 થી ઉપર
- સાઉથ ઈસ્ટ (South East) માટેના કરતાં વધારે ઊંચા કે જે 100,000 દીઠ 253.3 હતાં
- ઈંગ્લેન્ડ (England) માટેના કરતાં વધારે ઊંચા, કે જે 100,000 દીઠ 296.6 હતાં

બ્રાઈટન અને હોવ (Brighton & Hove) માટે આનો અર્થ શું થાય?

આપણા શહેરમાં કોવિડ -19 ના (COVID-19) ચેપનું દર- પ્રમાણ બધીજ ઉંમર- વયના જૂથોમાં ખૂબજ ઊંચું રહેવાનું ચાલુ રહ્યું છે, ખાસ કરીને યુવાન લોકોમાં.

કોવિડ-19 (COVID-19) સાથેની લોકોની સંખ્યા અમારી હોસ્પિટલોમાં વધી છે, આમ છતાં પણ, નવા વર્ષની આસપાસ જ્યારે કેસીસની સંખ્યા ખૂબજ વધારે હતી તેના કરતાં વધારે ઓછી રહી છે. આ બતાવે છે કે વેક્સિનેશનનો પ્રોગ્રામ કાર્ય કરી રહ્યો છે.

આમ છતાં પણ, આપણે વધારે જોઈ ખાતરી કરવાની રહે છે કે દરેકેદરેક વ્યક્તિ સુરક્ષિત રહે છે. આપણા શહેરના વેક્સિનેશનનું દર-પ્રમાણ દેશના ધણા વિસ્તારો કરતાં ઓછું રહ્યું છે. બ્રાઈટન અને હોવમાં (Brighton & Hove) ચાર પુખ્ત વયનાઓમાંથી ફક્ત ત્રણ વ્યક્તિએ તેઓનો પ્રથમ વેક્સિનેશન ડોસ મેળવ્યો છે.

25 થી 34 વર્ષની વયનાઓના સમુદાયમાં લેવાનું ઓછું રહ્યું છે. દસ વ્યક્તિઓમાંથી કેવળ છ વ્યક્તિએ આ વર્ષની વયના જૂથમાં વેક્સીન લેવાનું શરૂ કર્યું છે.

દરેકેદરેક વ્યક્તિ વેક્સીનની ઓફર લઈ લે તે મહત્વનું છે, ખાસ કરીને જ્યારે આપણામાંના ધણા બધા સામાજિક રીતે આપણા ઘરો અને શહેરના સમગ્ર સ્થળોમાં વળી પાછા ભેગા કે મિશ્ર કે મિક્સ થતા હોય છે.

કોવિડ-19 (COVID-19) માંથી વેક્સિનેશન એ શ્રેષ્ઠ રક્ષણ છે

યૂકેના દરેક પુખ્તવયનાઓને કોવિડ-19 (COVID-19) મળી રહે છે. જો તમે હજી સુધી વેક્સિનેશન લેવાનું શરૂ કર્યું ન હોય તો, કૃપા કરી વધારે લાંબા સમય માટે તે મુલતવી રાખશો નહિ.

કોઈ એક શહેર તરીકે આપણે બધાએ આપણી કમ્યુનિટીમાંના વલ્નરેબલ કે નિર્બળ લોકોની વિચારણા કરવાની રહે છે કે જો તેઓને આવો વાઈરસ પકડી લે તો તેઓને બીમાર થવાનો વધારે મોટો ભય-જોખમ રહે છે.

તમે જ્યારે વેક્સીન લો ત્યારે તમે કેવળ તમારી જાતનું રક્ષણ કરતા હોય તેવું હોતું નથી, પણ તમે તમારી આસપાસ દરેકનું આવા જોખમવાળા વાઈરસમાંથી રક્ષણ કરો છો.

બધાજ સ્થાનિક મોબાઇલ અને પોપ- અપ વેક્સિનેશનની ક્લિનિકસની વિગતો [ધ સસેક્સ હેલ્થ એન્ડ કેર](#) અને [NHS વોક-ઇન વેક્સિનેશન્સ](#) વેબસાઇટમાંથી મળી રહે છે.

તમારા વિસ્તારમાં આવી કોઈ એક વોક- ઈન કે ચાલીને જવાય તેવી ક્લિનિકસ આવે તેની રાહ જોવાની જરૂર નથી.

બ્રાઇટન સેન્ટરમાં (Brighton Centre) દરરોજ પહેલેથી બુક કરી શકાય તેવી વેક્સિનેશન્સની એપોઇન્ટમેન્ટસ [NHS નેશનલ વેક્સિનેશન બુકીંગ સર્વિસ](#) મારફતે અને 0300 303 8060 ઉપર ફોન કરવાથી બ્રાઇટન રેસ કોર્સ (Brighton Race Course) અને શહેરની આસપાસના બીજા સ્થળો માટે એપોઇન્ટમેન્ટસ મળી રહે છે.

બધાજ સ્થાનિક મોબાઇલ અને પોપ- અપ વેક્સિનેશનની ક્લિનિકસની વિગતો [ધ સસેક્સ હેલ્થ એન્ડ કેર](#) અને [NHS વોક-ઇન વેક્સિનેશન્સ](#) વેબસાઇટમાંથી મળી રહે છે.